

(153)

M. 14. 61. 5. 8 (S. C.) MB No-188

Schedule XLV-Form No. 134

BIRPUR TOLA G. N. BAWDHA TD

DIVISION

MAHADALIT TOLA BIDPUR-41AB12AN

SUB-DIVISION

TOLA

Anga Inkra Pvt Ltd.

Measurement Book

પ્રમાણિતકિયા જાણા છે કિ રૂ ૫
 માપી પાડે મશીન દાય આંકિ
 કુલ - 100 (પચાસી પ-ને છે) જો
 ૪૦ જી ઝપિલેય કુમાલ મદાય જ
 અભિયંત્ર અવલ કાર્ય પ્રમાણત
 પાલના કો નિર્ણિત કિયા જાણા છે


 23.02.17

Executive Engineer
 S.V.D. Works Dept.
 Gandhinagar

Sam/01
 23.02.17

Sch. XLV—Form No. 134

_____ DIVISION

_____ SUB-DIVISION

Measurement Book

No.

1st on A/c bill:-

1

Name of work--

Situation of work--

Agency by which work is executed--

Date of measurement--

No. and date of agreement.

(These four lines should be repeated at the commencement of the measurements relating to each work.)

Particulars	Details of actual measurement				Contents of area
	No.	L.	B.	D.	
Name of work: - construction					
of road from vihar					
Tola G.H. Bandh to					
mahadalit tola vihar					
Hazratn tola.					

Agency:- Area - infra Pvt. Ltd.

Agreement No:- 21 SRD/2016-17.

Rs. 86779142

Date of commencement:-
10-12-16.

Record measurement

① E/W calculation As per

calculation Graph & chart:-

chainage (m)	Fill Area (m ²)	mean Fill Area (m ²)	Dist ance (m)	Fill qty. (m ³)
0.00	3.20	-	-	-
50.00	6.68	4.940	50.00	247.00 m ³
100.00	5.775	6.227	50.00	311.35 m ³
150.00	7.605	6.690	50.00	334.50 m ³
200.00	6.187	6.896	50.00	344.80 m ³
250.00	5.460	5.823	50.00	291.15 m ³
300.00	4.800	5.130	50.00	256.50 m ³

Particulars	Details of actual measurement				Contents of area
	No.	L.	B.	D.	
Name of work: maintenance of road from Nisapur taluq G. H. Bandal to Mahadale taluq Nisapur Harizan taluq					
Name of Agency: P. S. Indga					
Est. No.: 21583/16-17					
Date of Commencement: 10-12-2016					
Date of Completion: 10-03-2019					
Date of entry: 20-05-23					
(item 1 to 4) P. S. Indga 30-05-23 (P. S. Indga 30-05-23)					
Record measurement					
① maintenance of 20 cement / Home bike culvert					
Est - 2 no					
② maintenance of road sign					
120 x 10 m = 1200 m					
= 1200 m 1.20 km					
③ maintenance of road sign					
120 x 10 m = 1200 m					
1 x 10 m = 10 m					
1210 m					
= 1210 m 1.210 km					
④ white washing of parapet					

Particulars	Details of actual measurement				Contents of area
	No.	L.	B.	D.	
	2 x	4 x	6 m x	0.60 m =	28.80 m ²
	2 x	4 x	0.60 x	0.40 m =	1.92 m ²
					40.32 m ²
30/5/23					
J-E					
(5) Restoration of Rain cuts -- cul comb 200					
	2 x	44 x	10 m x	1 m x 0.30 m =	264 m ³
(6) Maintenance at E/Shoulder -- cul comb 200					
	2 x	50 x	10 m x	0.70 m =	700 m ²
(7) Patch rubber over bot holes -- cul comb 200					
	90 x	1.20 m x	0.80 m =	86.40 m ²	
30/5/23					
J-E					

Abstract of cost					
(1) Maintenance at CO					
work					
Ob vide in dms no 3					
Pr 20 (75) item no (1)					
= 2 no					
@ 904.35/each → 18092					
(2) Maintenance at rd					
Sign					
Ob vide in dms on S P no					
(75) item no (2) = 1.20 km					
@ 895.88/km → 10752					
(3) Maintenance at 2002					
and km					

Continuation → 288420

↓ C.D

2884 =

Particulars	Details of actual measurement				Contents of area
	No.	L.	B.	D.	
alt vide in this m.B					
P. no (23) item no 3					
= 1.210m					
@ 481.22/m ² —					546 =
(4) white washing of parapet wall at CD work					
alt vide in this m.B					
P. no (80) item no 4					
= 40.32m ²					
@ 29.34/m ² —					1183 =
					4613 =
below 0.01% as per					0.00
avg					4613 =

(5) Restoration of road cut — — — at camp 225					
alt vide in this m.B P. no (80)					
item no (5) = 264m ² @ 321.51/m ²					84879 =
(6) maintenance of F/shoulder					
alt vide in this m.B P. no 80					
item no (6) = 700m ² @ 49.07/m ²					34349 =
(7) Patch repair over pot holes					
alt vide in this m.B P. no (80)					
item no (7) = 8640m ² @ 269.49/m ²					23284 =
					147125 =
below 0.01% as per					15 =
					147110 =

30/5/23
J.E30/5/23
A.R.Continuation
29/6/24
J.E